

SEAT No.

[4/A-3]

EVR

No. of Printed Pages: 4

Sardar Patel University
 B.Sc. Semester-4 Examination
 Subject:- Inorganic Chemistry
 Paper Code - US04CCHE01



Date: 3-10-2022

Time: 12.30 P.M. to 2.30 P.M.

Day: Monday

Total Marks: 70

Note: (1) All questions are to be attempted

(2) Figures to the right indicate full marks.

Q.1 Choose the correct option and rewrite answer of the following. 10

1. Which pair of elements of the following shows similar properties and hence difficult to separate them?
 (a) Ru-Os (b) Ru-Rh (c) Mo-Re (d) Y-La
2. $[\text{Ni}(\text{H}_2\text{O})_6]^{2+}$ is blue green in colour whereas $[\text{Ni}(\text{NH}_3)_6]^{2+}$ is -----.
 (a) Yellow (b) Red (c) Blue (d) Blue green.
3. According to Werner's theory metal atom in coordination compound show.....
 (a) Only primary valency (b) secondary valency
 (c) tertiary valency (d) both primary and secondary valency
4. Which of the following square planar complexes exist in cis and trans isomeric form?
 (a) Ma_2b_2 (b) Ma_4 (c) Ma_3b (d) Mabcd
5. $\{\text{Rn}\}5\text{f}^{12}6\text{d}^07\text{s}^2$ is electronic configuration of which elements ?
 (a) U (b) La (c) Fm (d) Na
6. The most stable oxidation state of lanthanide is ----.
 (a) +1 (b) +3 (c) +2 (d) +4
7. Which of the most widely used extracting solvent for lanthanides ?
 (a) TBP (b) Xylene (c) Kerosene (d) none of them
8. ----- is not obey EAN rule.
 (a) $[\text{Mn}(\text{CO})_6]$ (b) $[\text{Cr}(\text{CO})_6]$ (c) $[\text{Fe}(\text{CO})_5]$ (d) $[\text{Ni}(\text{CO})_4]$
9. The metal in carbonyls are in ----- oxidation state.
 (a) -6 (b) +2 (c) 0 (d) +7
10. Which of the following metallic carbonyl is not diamagnetic?
 (a) $[\text{Cr}(\text{CO})_6]$ (b) $[\text{V}(\text{CO})_6]$ (c) $[\text{Fe}(\text{CO})_5]$ (d) $[\text{Ni}(\text{CO})_4]$

Q.2 Choose the correct option and fill in the blanks. 08

1. ----- is not π acid ligand. (CO , NH_3)
2. Which of the following group of transition elements have lowest value of their melting point.
 [(Zn, Hg and Cd), (Mn, Te and Re)]
3. According to Werner's theory metal atom in coordination compound show-----.
 [both primary and secondary valency, only primary valency]
4. Cis and trans isomers are called as -----isomerism. [geometrical, optical].

(1)

(P.T.O.)

5. ----- is most efficient method for separation of lanthanides. [Ion exchange, Recrystallization]
6. $[Rn5f^6d^17s^2$ is the electronic configuration of ----- elements in its ground state.
[Neptunium, Uranium]
7. The number of bridging carbonyl group present in $[Fe_2(CO)_9]$ are -----. [2, 3]
8. ----- is not obey EAN rule. [$[Mn(CO)_5]$, $[Cr(CO)_6]$]

Q.3 Answer the following short questions (Any ten)

20

1. Give the applications of magnetic moments value.
2. Why d-block elements show variable oxidation state ?
3. Explain the stability of complex compound of d-block elements.
4. Give the molecular formula of all the hydrate isomers of $CrCl_3 \cdot 6H_2O$.
5. Draw the structure of optical isomer of $[Cr(C_2O_4)_3]^{3-}$.
6. Give the condition for a molecule to show optical isomerism.
7. List the modern methods used for the separation of Lanthanides.
8. What is actinides contraction ?
9. Give use of lanthanides in paint industries.
10. Calculate EAN of $Mn_2(CO)_{10}$.
11. Classify the metallic carbonyls giving suitable examples.
12. Draw the structure of $Fe_3(CO)_{12}$.

Q.4 Answer the following questions. (Any four)

32

1. Give the name, symbol and electronic configuration of 3rd transitions series elements.
2. Discuss the classification of d-block elements.
3. Describe Grinberg's method to distinguish between cis and trans isomers of $[Pt(NH_3)_2Cl_2]^0$.
4. Discuss Geometrical isomerism of octahedral complexes.
5. Describe the ion-exchange method for separation of Lanthanides.
6. Give the name, symbol, atomic number and electronic configuration of actinides elements.
7. Discuss the nature of M-CO bonding in metal carbonyl.
8. Discuss the Preparation, Properties and structure of $[Cr(CO)_6]$.

SEAT No. _____

સરદાર પટેલ યુનિવર્સિટી
બી. એસ. સી. સેમેસ્ટર - ૪ પરીક્ષા
વિષેય : અકાર્બનિક રસાયણ શાસ્ત્ર



પેપર કોડ: - US04CCHE01

તારીખ: ૩-૧૦-૨૦૨૨

સમય: બાજુરે ૧૫૩૦ થી ૨:૩૦

દિવસ : સોમવાર

કુલ ગુણ: ૭૦

સુચના : (૧) દરેક પ્રશ્નના જવાબ આપો.

(૨) પ્રશ્નની જમણી બાજુ દર્શાવેલાં અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

- | | |
|--|-----------|
| <p>પ્ર. ૧ સાચો વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. ૧૦</p> <p>૧. નીચેના ઘટકોની કઈ જોડી સમાન ગુણધર્મો દર્શાવે છે અને તેથી તેમને અલગ કરવા મુશ્કેલ છે ?
 (અ) Ru-Os (બ) Ru-Rh (ક) Mo-Re (સ) Y-La</p> <p>૨. $[\text{Ni}(\text{H}_2\text{O})_6]^{2+}$ રંગ વાદળી લીલો છે, જ્યારે $[\text{Ni}(\text{NH}_3)_6]^{2-}$ નો રંગ----- છે.
 (અ) પીળો (બ) લાલ (ક) વાદળી (સ) વાદળી લીલો.</p> <p>૩. વર્નરની શિથરી પ્રમાણે સંકીર્ણ સંયોજનમાં ધાતુ પરમાણ દર્શાવે છે.
 (અ) માત્ર પ્રાથમિક સંયોજકતા (બ) દ્વિત્યક સંયોજકતા
 (ક) તૃતીય સંયોજકતા (સ) બંને પ્રાથમિક સંયોજકતા અને દ્વિત્યક સંયોજકતા.</p> <p>૪. નીચેના સમતલીય યોરસ સંકીર્ણ સંયોજનમાં સીસ અને ટ્રાન્સ સમઘટકિય સ્વરૂપ અસ્તિત્વમાં છે?
 (અ) Ma_2b_2 (બ) Ma_4 (ક) Ma_3b (સ) Mabcd</p> <p>૫. કયા તત્ત્વની ઇલેક્ટ્રોનિક રચના $\{\text{Rn}\}5\text{f}^26\text{d}^07\text{s}^2$ છે ?
 (અ) U (બ) La (ક) Fm (સ) Na</p> <p>૬. લેન્ઝેનાઈડની સૌથી સ્થિર ઓક્સિડેશન સ્થિતિ ----- છે.
 (અ) +1 (બ) +3 (ક) +2 (સ) +4</p> <p>૭. લેન્ઝેનાઈડ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો નિર્ણયિત ગ્રાવક કયો છે ?
 (અ) TBP (બ) આયલીન (ક) કેરોસીન (સ) આ પૈકીના એકેય નહીં.</p> <p>૮. -----EAN નિયમનું પાલન કરતું નથી
 (અ) $[\text{Mn}(\text{CO})_6]$ (બ) $[\text{Cr}(\text{CO})_6]$ (ક) $[\text{Fe}(\text{CO})_6]$ (સ) $[\text{Ni}(\text{CO})_4]$</p> <p>૯. કાર્બોનીલમાં ધાતુની ઓક્સિડેશન સ્થિતિ ----- છે.
 (અ) -6 (બ) +2 (ક) 0 (સ) +7</p> <p>૧૦. નીચેનામાંથી કયો ધાતુ કાર્બોનીલ પ્રતિયુબ્ધીય નથી?
 (અ) $[\text{Cr}(\text{CO})_6]$ (બ) $[\text{V}(\text{CO})_6]$ (ક) $[\text{Fe}(\text{CO})_6]$ (સ) $[\text{Ni}(\text{CO})_4]$</p> | <p>૧૦</p> |
| <p>પ્ર. ૨ સાચો વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા ભરો ૦૮</p> <p>૧. ----- પી એક્સિડ લિગાન્ડ નથી. (CO, NH_3)</p> | |

2. સંકાતિ તત્વોના નીચેનામાંથી કયા જીથમાં તેમના ગલબનબિંદુનું મૂલ્ય સૌથી ઓછું છે.
[(Zn, Hg અને Cd), (Mn, Te અને Re)]
3. વર્ણરની શિયરી અનુસાર સંકીર્ણ સંયોજન ----- ધરાવે છે.
[પ્રાથમિક અને ગૌણ વેલેન્સી બંને, માત્ર પ્રાથમિક વેલેન્સી]
4. સીસ અને ટ્રાન્સ સમઘટકને ----- સમઘટકતા કહેવામાં આવે છે. [લૌભિતિક, પ્રકાશીય]
5. ----- લેન્થેનાઈડસને અલગ કરવાની સૌથી અસરકારક પદ્ધતિ છે.
[આયન વિનિમય, પુનઃસ્ક્રીકરણ]
6. ----- તત્વની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનિક વિન્યાસ $[Rn5f36d17s2]$ છે. [નેપ્ટ્યુનિયમ, ચુરેનિયમ]
7. $[Fe_2(CO)_9]$ માં બ્રિજિંગ (પુલ) કાર્બોનિલ સમુહની સંખ્યા ----- છે. [2, 3]
8. ----- એ EAN નિયમનું પાલન કરે છે. [$[Mn(CO)_5]$, $[Cr(CO)_6]$]

પ્ર. 3 નીચેના પ્રશ્નોના ટ્રેકમાં જવાબ આપો.. (ગમે તે દસ)

1. ચુંબકીય ચાકમાત્રા મૂલ્યની ઉપયોગીતા આપો.
2. d-બ્લોક તત્વો વિવિધ ઓક્સિડેશન સ્થિતિ શા માટે દર્શાવે છે ?
3. d- block તત્વોના સંકીર્ણ સંયોજનની સ્થિરતા સમજાવો.
4. $CrCl_3 \cdot 6H_2O$ ના બધા હાઇડ્રેટ સમઘટકોના અણુસૂત્ર આપો.
5. $[Cr(C_2O_4)_3]^{3-}$ ના પ્રકાશીય સમઘટકનું બંધારણ દોરો.
6. પ્રકાશીય સમઘટક દર્શાવવા માટે અણુની જરૂરી શરતો જણાવો.
7. લેન્થેનાઈડને અલગ કરવા માટે ઉપયોગમાં લેવાતી આધુનિક પદ્ધતિઓની ચાર્ટી આપો.
8. એકટીનાઈડ સંકોચન એટલે શું ?
9. પેટન્ટ ઉદ્ઘોર્ણમાં લેન્થેનાઈડનો ઉપયોગો જણાવો.
10. $Mn_2(CO)_{10}$ ના EAN ની ગણતરી કરો.
11. થોરય ઉદાહરણો આપી ધાતુ કાર્બોનિલને વર્ગીકૃત કરો..
12. $Fe_3(CO)_{12}$ નું બંધારણ દોરો .

૨૦

પ્ર. 4 નીચેના પ્રશ્નોના જવાબ આપો. (ગમે તે ચાર)

1. ત્રીજી સંકાતિ શ્રેણીના તત્વોના નામ, સંજ્ઞા, અને ઇલેક્ટ્રોનિક રચના આપો..
2. d-બ્લોક તત્વોના ઘટકોના વર્ગીકરણની ચર્ચા કરો..
3. સંકીર્ણ $[Pt(NH_3)_2Cl_2]^0$ ના સીસ અને ટ્રાન્સ સમઘટક વચ્ચેનો લેદ સમજાવવાની ગ્રીનબર્ગ. પદ્ધતિનું વર્ણન કરો
4. અષ્ટકલકીય સંકીર્ણના લૌભિતિક સમઘટકની ચર્ચા કરો.
5. લેન્થેનાઈડને અલગ કરવા માટે આયન-વિનિમય પદ્ધતિનું વર્ણન કરો.
6. એકટીનાઈડ તત્વોના નામ, સંજ્ઞા, પરમાણુ કર્માંક અને ઇલેક્ટ્રોનિક રચના આપો .
7. ધાતુ કાર્બોનિલમાં M-CO બંધન પ્રકૃતિની ચર્ચા કરો
8. $[Cr(CO)_6]$ ની બનાવટ, ગુણધર્મો અને બંધારણની ચર્ચા કરો.

૩૨

—X—

(4)